

Visit of H.E. Mr. Nikola Selaković, Minister of Foreign Affairs of Serbia to India

September 21, 2021

સર્બિયાના વિદેશમંત્રી નિકોલા સેલાકોવિકની ભારત મુલાકાત

સપ્ટેમ્બર 21, 2021

સર્બિયાના વિદેશ મંત્રી મહામહિમ નિકોલા સેલાકોવિચે સર્બિયાના રાષ્ટ્રપતિના વિશેષ દૂત તરીકે 19-20 સપ્ટેમ્બર 2021ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી.

2. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી તેમજ અને વિદેશમંત્રી ડો. એસ. જયશંકર અને વિદેશ રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી સાથે ચર્ચા કરી હતી.

3. નોન-એલાઈન્ડ મુવમેન્ટના સહ-સ્થાપક તરીકે ભારત અને સર્બિયા પરંપરાગત રીતે પારસ્પરિક મહત્વના દ્વિવપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ગાઢ સહકાર દ્વારા નજીકના અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ભારતીય પક્ષે પ્રથમ નામ પરિષદની 60 મી વર્ષગાંઠ નિમિત્તે 11-12 ઓક્ટોબર 2021ના રોજ બેલગ્રેડમાં સ્મારક કાર્યક્રમના આયોજન બદલ સર્બિયાને સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

4. બંને પક્ષોએ દ્વિવપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ કરવા અંગેના વ્યાપક આદાનપ્રદાન કર્યા હતા, જેમાં આગામી મહિનાઓમાં વિદેશ મંત્રાલયના પરામર્શના આગામી રાઉન્ડ અને આર્થિક સહકાર અંગેના સંયુક્ત આયોગનો સમાવેશ થાય છે. તેઓએ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન -પ્રદાન ચાલુ રાખવા પર પણ સંતોષ વ્યક્ત કર્યો અને કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટી અને આઈટીઈએસ, હેવી એન્જિનિયરિંગ, મશીનરી અને સાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો અંગે ચર્ચા કરી.

5. બંને પક્ષોએ એકબીજાના રાષ્ટ્રીય સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા કોવિડ રસી પ્રમાણપત્રોની માન્યતા પર પારસ્પરિક વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવાનું સ્વાગત કર્યું હતું. તેનાથી લોકો વચ્ચેના સંપર્કોને પ્રોત્સાહન મળશે અને વેપાર હેતુઓ માટે મુસાફરી કરી શકાશે.

6. મુલાકાત દરમિયાન રાજદ્વારી મિશન અને કોન્સ્યુલર પોસ્ટ્સના સભ્યોના આશ્રિતો માટે લાભદાયી રોજગાર અંગે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

7. અંને મંત્રીઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓ એ બાબતે સંમત થયા કે કાયદાનું શાસન અને સાર્વભૌમત્વ માટે આદર અને પ્રાદેશિક અખંડિતતા આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત સિદ્ધાંતો છે જેનું બધાએ પાલન કરવું જોઈએ.

નવી દિલ્હી
સપ્ટેમ્બર 21, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.